



MBD-001-02014110 Seat No. _____

B. A. (Economics) (Sem. I) (CBCS) Examination

November / December – 2016

Paper - I : Principles of Economics - I
(Core)

Faculty Code : 001

Subject Code : 02014110

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) દરેક પ્રશ્નના ગુણ સામે દર્શાવવામાં આવ્યા છે.

(૨) પ્રશ્નોના જવાબ આંતરિક વિકલ્પના આધારે આપો.

૧ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો. ૧૪

અથવા

૧ અર્થશાસ્ત્રના નિયમોની મર્યાદા અને મહત્ત્વ વિષે નોંધ લખો. ૧૪

૨ રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા ચર્ચો. તેની મર્યાદાઓ જણાવો. ૧૪

અથવા

૨ એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની સંપત્તિલક્ષી વ્યાખ્યા સમજાવો. તેની મર્યાદાઓ જણાવો. ૧૪

૩ તુષ્ટિગુણનો ખ્યાલ સમજાવો. તુષ્ટિગુણ વિશ્લેષણની ધારણાઓ સમજાવો. ૧૪

અથવા

૩ ઘટતા સીમાંત તુષ્ટિ ગુણનો નિયમ સમજાવો. તેનું મૂલ્યાંકન કરો. ૧૪

૪ માંગની મૂલ્યસાપેક્ષતાનો ખ્યાલ સમજાવો. તેના પ્રકારો ચર્ચો. ૧૪

અથવા

૪ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું ? માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતાં પરિબલો ચર્ચો. ૧૪

- ૫ ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) ૧૪
- (૧) માંગની સામસામી સાપેક્ષતા
- (૨) માંગની આવક સાપેક્ષતાના પ્રકારો
- (૩) અર્થશાસ્ત્રની કલયાણલક્ષી વ્યાખ્યા ટૂંકમાં સમજાવો.
- (૪) અર્થશાસ્ત્રના નિયમોને ભરતી અને ઓટના નિયમો સાથે શા માટે સરખાવવામાં આવે છે ?

ENGLISH VERSION

- Instructions :** (1) Figures in the right Side Indicates Marks.
- (2) Give answer question on the basis of internal option.

- 1 Give definition of Economics. Explain the nature and scope of economics. 14

OR

- 1 Write note on limitation and importance of economics law. 14
- 2 Discuss the Robin's definition of economics. Give its limitations. 14

OR

- 2 Explain wealth definition of economics, Given by Adam Smith. Give its limitations. 14
- 3 Explain the concept of Utility. Explain the assumptions of utility analysis. 14

OR

- 3 Explain the law of diminishing marginal utility. Evaluate it. 14

- 4 Explain the concept of price elasticity of demand. 14
Discuss its types.

OR

- 4 What is price elasticity of Demand. Discuss the factors 14
affecting price elasticity of demand.
- 5 Write Short notes : (any two) 14
- (1) Cross Elasticity of Demand
 - (2) Types of income elasticity
 - (3) Explain in brief the welfare definition of economics
 - (4) Why are the laws economics compared with the tide and ebb?
-